

કલમ-૪(૧)ખ(૧૭)

રોડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ

સુરત મહાનગરપાલિકા.

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

માહિતીનો અધિકાર અધિનિયમ અંગેની ફાઈલો/અરજીઓ/પત્રવ્યવહાર/અપીલની ફાઈલોના દફ્તર વર્ગીકરણ બાબત.

નં. આરટીઆઈ સેલ/૨૭૪
તા. ૧૮-૧૦-૨૦૧૪

નોંધ:-

નાયબ સચિવશ્રી (આરટીઆઈ), સામાન્ય વહીવટી વિભાગ, ગાંધીનગરના પત્રકમાંક : પરચ-૧૦૨૦૦૮-૪૨૮૮૭૧-આરટીઆઈ સેલ તા.૨૦-૮-૨૦૦૮ ની નકલ કલેકટર કચેરી, સુરતના જનસંપર્ક અધિકારીશ્રી પાસેથી મેળવી આ સાથે સામેલ કરેલ છે. જેમાં આરટીઆઈ એકટ-૨૦૦૫ અંગેની ફાઈલોનું વર્ગીકરણ કયા વર્ગમાં કરવું તે દર્શાવવામાં આવેલ છે. તે મુજબ વર્ગીકરણ અંગેની કાર્યવાહી કરવા તમામ જોન/ખાતાના અધિકારીઓને જણાવવામાં આવે છે.

સહી/-

ડ. કમિ. (ફા)અને

નોડલ ઓફિસર

રાઇટ ટુ ઇન્ફર્મેશન સેલ

સુરત મહાનગરપાલિકા

નકલ સ. રવાના :- તમામ વિભાગીય વડાશ્રીઓ/ઝોનલચીફશ્રી પ્રતિ.....જાણ તથા તાબાના સ્ટાફને તે મુજબ અમલ માટે સુચિત.

નકલ રવના :- તમામ ખાતાકીય વડાશ્રીઓ પ્રતિ... જાણ તથા અમલ માટે.



ના. આરટીઆઈ સેલ/ 13
તા. 26 / 04 / 2024

પ્રતિ,
તમામ જાહેર માહિતી અધિકારી અને
તમામ અપીલ અધિકારી
સુરત મહાનગરપાલિકા
સુરત.

RDD/IN/NO. 219
DATE ૦૭૦૫૨૦૨૪

વિષય :— માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ અન્યથે દરેક જાહેર સામંજણના
'પ્રોએક્ટીવ રીસ્કલોગ' (પી.એ.ડી.) નું ઇન્સ્પેક્શન-કમ-ઓર્ડિટ કરવા બાબત.

સંદર્ભ :— સેક્શન અધિકારીશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરનો તા. ૨૮/૦૫/૦૯
નો પત્રકમાંક: પી.એ.ડી./૧૦૨૦૮/૧૭૨૦/૪ (સદર પત્ર સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ
<http://10.11.1.8> ઉપર RTI માં અ.નં. ૧૧ ઉપર આરટીઆઈ સેલદ્વારા બહાર પાડવામાં
આવેલ નોંધ/પરિપત્રોમાં અ.નં. ૧૧ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે)

ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ પ્રમાણે દરેક જાહેર
સામંજણના દરેક જાહેર માહિતી અધિકારીએ તેઓના નિયંત્રણ/તાબા ડેટાના જોન/આતાઓની સ્વચ્છ જાહેર કરવા યોગ્ય
માહિતી પૂરી વિગતે ૧લી મેળી સિદ્ધિને અધિતન કરવાની કામગીરી પ્રતિ વર્ષ પૂરી કરવાની રહે છે. સંદર્ભમાં જણાવેલ પત્ર
મુજબ પ્રત્યેક જાહેર સાથ મંડળ કલાયેલી આ કાર્યવાહી દર વર્ષની ઊંચી જૂન સુધીમાં પૂરી કરી આ સાથે સામેલ
'એનેક્ષર-એ' માં દર્શાવ્યા મુજબનું પ્રમાણપત્ર દર વર્ષની ૧૫મી જૂલાઈ સુધીમાં સચિવાલય, વધીવારી વિભાગને મોકલી
આપવાનું હોય છે. તે મુજબ તા. ૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરી તે અંગેની જાણ અને કરવા દરેક જાહેર માહિતી
અધિકારીઓને જણાવવામાં આવે છે. આ બાબતે મ્યુનિશિપલશ્રી કલાયેલી તથા વહીવારી વિભાગ તરફથી ઓર્ડિટ-કમ-
ઇન્સ્પેક્શન થનાર હોઈ કાતિપૂર્ણ અંગેની જવાબદારી લાગત જાહેર માહિતી અધિકારી/આતાઅધિકારી/વિભાગીય અધિકારીની
રહેશે.

એકંદરે નિરીક્ષણમાં એ બાબત પણ ધ્યાને આવેલ છે કે મુદ્દા નં. ૨ થી ૮ ની વિગતો હજુ પર્યાન માત્રામાં વેબસાઈટ
ઉપર મુક્કેલ જણાતી નથી. મુદ્દા નં. ૮ અને ૧૦ માં ખાતા/જોન/વિભાગમાં કરજ બજાવતા અધિકારી/કમચારીઓની માહિતી
સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ હોવાનું
જણાવવામાં આવે છે. તેની જગ્યાને હવેથી મુદ્દા નં. ૮ અને ૧૦ માં વેબસાઈટનો ડાલ્યો ન આપતા પોતાના
ખાતા/જોનની માહિતી પ્રસિદ્ધ કરવાની રહેશે. દરેક જોન/આતાએ મુદ્દા નં. ૧ થી ૧૭ માં પ્રસિદ્ધ કરવામાં આવેલ
માહિતીનો પુન: અભ્યાસ કરી પોતાના જોન/આતાને લાગત વધુમાં વધુ માહિતીનો લાગત મુક્કેલ અવશ્ય સમાવેશ
કરવો.

મુદ્દા નં. ૧૭: હરાવવામાં આવે તેવી બીજી માહિતીમાં લાખમાં જે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે
ઉપરાંત અનેના આઉટવર્ક નં. આરટીઆઈ સેલ/૨૪૧, તા. ૧૧/૧૧/૨૦૧૩ (10.11.1.9- Imp. Circular અ.નં.૪૪) થી
આપવામાં આવેલ સુચના મુજબ આરટીઆઈ હેઠળની અરજી માટે રજીસ્ટર નમૂનો-૧ અને અપીલ અરજી માટે
રજીસ્ટર નમૂનો-૨ ની માહિતી નં. આરટીઆઈ સેલ/૭૨૮, તા. ૨૭/૦૮/૨૦૧૨ (10.11.1.9- Imp. Circular
અ.નં.૩૫) ની સુચના મુજબ પૂર્ણ ઓળખ જાહેર ન થાય તે રીતે તા. ૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ ના સમયગાળા
માટેની પ્રસિદ્ધ કરવાની રહેશે.

પ્રોએક્ટીવ રીસ્કલોગ અધિતન દર્શાવ્યા અંગેનું 'એનેક્ષર-એ'નું પ્રમાણપત્ર અનેના આરટીઆઈ સેલ વિભાગને
મોકલી આપવા તથા પ્રોએક્ટીવ રીસ્કલોગના મુદ્દા નં. ૧ થી ૧૭ ની હાઈ કોપી તથા સોફ્ટ કોપી અનેની જાણ હેઠળ
આઈએસડી વિભાગને મોકલી આપવા જણાવવામાં આવે છે.

વધુમાં તા. ૩૧/૦૩/૨૦૨૪ સુધીના પ્રથમ અપીલ અંગેના હુકમો પણ અરજદારની પૂર્ણ ઓળખ જાહેર ન થાય તે
રીતે અનેની જાણ હેઠળ આઈએસડી વિભાગને પ્રસિદ્ધ કરવા માટે સોફ્ટ કોપીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

QED
રૂપુણ મ્યુનિશિપલ
અને નોડલ ઓફિસર
રાઈટ ટુ ઇન્ફોશન સેલ
સુરત મહાનગરપાલિકા

નક્ષે સાદર રવાના: મ્યુનિશિપલ પ્રસિદ્ધ કરવા માટે
નક્ષે સ. રવાના : તમામ વિભાગીય વડાશ્રીઓ પ્રતિ... જાણ તથા અમલ કરાવવા સારું.

(P.T.O.)

અગ્રણી

પત્રકમાંંક: પરિય. ૧૦૨૦૫-૪૨૯૬૭૧-આરટીઆઈ સેલ

સામાન્ય વહીવટ વિભાગ,

સચિવાલય, આધીનકર

દિ. ૩૦-૮-૨૦૦૬

યુદ્ધ

શ્રી હો. મનીલલેવસ, I.A.S.

આર્પ્ર. સચિવશ્રી

સાહેબજીનું વિભાગ,

સચિવાલય આધીનકર

(વિષય: માહિતી અપિકાર અપિલિયમ અંગે ની ફાઇલ/અરજીઓ/પત્રવ્યવસ્થા/અપીલની ફાઇલોની કાઢાણી કેન્દ્ર)

વગ્નાકરણ બિલ્ડા

સાહેબજી શ્રીમાન,

(સ્થળ) ઉપરોક્ત વિષય અંગે જ્ઞાનવાળું કે માહિતી અપિકાર અપિલિયમ અંગેની ફાઇલો / અરજીઓ / પત્રવ્યવસ્થા / અપીલની ફાઇલોનું વગ્નાકરણ કરવા વર્ગમાં કર્યું તે બાબતની પુના વિચારણા કરી બા અંગેની સરવાતી સૂચનાઓ સા.વ.વિભાગ/વસ્તુાપ-૧ ના ના.૧/૬/૨૦૦૯ ના કાર્યવે ક્રમાંક: પરિય. ૧૦૨૦૫/ઝાંખોભાઈ/૧૧/વસ્તુાપ-૧ થી પુલિલ કરાણમાં આવી છે

૨/ સંદર્ભ કાલાવાના પરિષિષ્ઠ-૬ ના ક્રમ-૫૭ (સાલાંથે બિલ્ડા છે) ઉપર માહિતી અપિકાર અપિલિયમ અંગેની ફાઇલો / અરજીઓ / પત્રવ્યવસ્થા / અપીલની ફાઇલો વગ્ને બાબતની ફાઇલોનું વગ્નાકરણ કરવા વર્ગમાં કર્યું તે દર્શાવવામાં આવેલ છે

૩/ કાર્યવે વગ્નાકરણ અંગેની આ સરવાતી-સૂચનાઓ પેડિની માહિતી અપિકાર અપિલિયમ અંગેની ફાઇલો/અરજીઓ/ પત્રવ્યવસ્થા/અપીલની ફાઇલોના વગ્નાકરણ બાબતની રૂપા પેડા-૨ માં દર્શાવવામાં આવેલ બા �SPECIFIC સંયાન પુલિલ થાય છે, ત્યારે બા સીએપીસી સૂચના સર્વે વિભાગો અને વિલાગોના નિયંત્રણ કેન્દ્રના સર્વે જાહેરતાના મંડળોના દ્વારા લાવવા આ માણે મોકલવામાં આવે છે, આથી બા સરવાતી સૂચના પ્રયાને લાય તે મુજબની આર્થવાફી કરવા / કશવા વિનંતી છે.

આપનો વિભાગ:

સીએપીસીએપીસી

નાયબ સચિવ (આરટીઆઈ)

સામાન્ય વહીવટ વિભાગ.

(નિર્ણય: ના.૧/૬/૨૦૦૯ ના કાર્યવે ના પરિષિષ્ઠ-૬ ના ક્રમ-૫૭નો ઉત્તારો)

૧૮૨/૧૩૨/૧૮૧

૧૮૧

૧૦/

૧૮૧૮/૧૮૧૮]

// ૨ //


અયાંકા - ભારતીયાઈ-૧૦૨૦૦૮ / RTI-232 / ન.૧,

મહેસૂલ વિભાગ,
સચિવાલય, ગાંધીનગર,
તા. ૮/૧૦/૨૦૦૮.

નાણ જાણ તથા જરરી કાર્યવાલી અથે છુનેલેવા સાર રવાના:-

પ્રતિ,

- સર્વે સંપૂર્ણ સચિવશ્રી/ નાયામ સચિવશ્રી અને પેરેટ ખોલોરીએ,
- મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સર્વે જાહેર માહિતી અધિકારી અને ઉપસચિવશ્રી, મહેસૂલ વિભાગ, સચિવાલય,
ગાંધીનગર.
- સર્વે મદદનારી જાહેર માહિતી અધિકારી અને શેકાન અધિકારીશ્રી, મહેસૂલ વિભાગ,
સચિવાલય, ગાંધીનગર.
- મહેસૂલ વિભાગ દસ્તકના તમામ ખૂબાના પડાયો (તમામ કલેકટર સહિત)
- મ.૨, જ. જ, ક, ક.૧, ન, સ.૩, અને પુ.૧. રાખા, મહેસૂલ વિભાગ, સચિવાલય,
ગાંધીનગર. આ અગત્યની લૂંઘણાઓ તેવાં નિયંત્રણ મુઠળા સર્વે જાહેર સતત મંડળોના
અને લાગવા અને તે મુજબની કાર્યવાલી કરવા/કરાવવા વિનંતી છે.



(અ. એન. ગોપની)
ઉપસચિવ,
મહેસૂલ વિભાગ, મુખ્યમંત્રીના રાજ્યાભિયાસ.

તા.૦૧/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૪ સુધીની આર.ટી.આઈ.હેઠળની અરજી માટે ૨જીસ્ટર નમૂનો—૧ અને ૨જીસ્ટર નમૂનો—૨ ની માહિતી.

અરજી

- (૧) એપ્રિલ થી જુન—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૧
- (૨) જુલાઈ થી સપ્ટેમ્બર—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૧
- (૩) ઓક્ટોબર થી ડિસેમ્બર—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૧
- (૪) જાન્યુઆરી થી માર્ચ—૨૦૨૪ ૨જીસ્ટર નમૂનો—૧

અપીલ

- (૧) એપ્રિલ થી જુન—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૨
- (૨) જુલાઈ થી સપ્ટેમ્બર—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૨
- (૩) ઓક્ટોબર થી ડિસેમ્બર—૨૦૨૩ ૨જીસ્ટર નમૂનો—૨
- (૪) જાન્યુઆરી થી માર્ચ—૨૦૨૪ ૨જીસ્ટર નમૂનો—૨

જાહેર માહિતી અધિકારી
અને ડેપ્યુટી ઈજનેર
રોડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
સુરત મહાનગરપાલિકા.

સુરત મહાનગરપાલિકા

અનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક :— પીએડી—૧૦—૨૦૦૭— ૩૩૫૩૬૪—
આરટીઆઈ સેલનું બિડાણ)

—:: પ્રમાણપત્ર ::—

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની
યાદી મુજબના જાહેર સત્તામંડળો ધ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ—૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની
બાબતો (પ્રોએક્ટીવ ડીસ્કલોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે અને તા.૦૧—૦૫—૨૦૨૪ ની સ્થિતિએ તે
અધતન કરવામાં આવેલ છે, જેનું અમારા ધ્વારા માહે મે—૨૦૨૪ દરમ્યાન ઇન્સ્પેક્શન—કમ—ઓડીટ કરવામાં
આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

તા.૩૦—૦૬—૨૦૨૪ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તા મંડળોના પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (પી.એ.ડી.) નું
ઇન્સ્પેક્શન—કમ—ઓડીટ બાકી રહેલ નથી.

તારીખ:-

મુખ્ય મથક:- સુરત મહાનગરપાલિકા

ઓડી. સીટી ઇજનેર
સુરત મહાનગરપાલિકા

દશ્ંતર વર્ગીકરણની સુચના

(સા.વ.વિભાગનાં તા.૦૮-૦૬-૨૦૦૮ ના ઠરાવ ક્રમાંક : પરચ-૧૦૨૦૦૫-જીઓઆઈ ઉ૭-વસૃતાપ્ર,૧ નું પરિશિષ્ટ-૬)

પદ	માહિતી મેળવવાના અધિકારને લગતો કાયદો(રાઈટ ટૂ ઈન્ફોમેશન એક્ટ)	
(૧)	ઠરાવો/હુકમો પરિપત્રો વિગેરે નિતી વિષયક ફાઈલો	૫
(૨)	આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરતે જાહેર માહિતી અધિકારીએ આપેલ /અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો જેના ઉપર પ્રથમ અપીલ ન થઈ હોય તેવી ફાઈલો	૬
(૩)	આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરતે જાહેર માહિતી અધિકારીએ આપેલ /અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો (જેના પર એપેલેટ ઓથોરીટી સમક્ષ પ્રથમ અપીલ થઈ હોય પરંતુ રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ ન થઈ હોય તેવી ફાઈલો)	૬
(૪)	આર.ટી.આઈ. એક્ટ હેઠળની અરજી પરતે જાહેર માહિતી અધિકારીએ આપેલ /અંશતઃ આપેલ/નહી આપેલ માહિતીની ફાઈલો (જેના પર રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ થઈ હોય, અને માહિતી આયોગના આદેશો મુજબની કાર્યવાહી સંપૂર્ણ થઈ ગયેલ હોય તેવી ફાઈલો)૩	૬
(૫)	જાહેર માહિતી અધિકારીના નિર્ણય સામે પ્રથમ અપીલ / બીજી અપીલ અને તે અન્વયે માહિતી આયોગના ચુકાદા સામે વડી અદાલતમાં રીટ પીટીશન થઈ હોય, તો તેવી પીઆઈઓની ફાઈલો.	૫-૧
(૬)	જાહેર માહિતી અધિકારીના નિર્ણય સામે અરજદારે એપેલેટ ઓથોરીટીને કરેલ પ્રથમ અપીલ અંગેની ફાઈલ (જેની સામે ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ થઈ ન હોય)	૬
(૭)	અરજદારે એપેલેટ ઓથોરીટીને કરેલ પ્રથમ અપીલ અંગેની ફાઈલો જેની સામે ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ થઈ હોય અને આયોગના ચુકાદો મુજબની કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલ હોય)	૬
(૮)	એપેલેટ ઓથોરીટીના પ્રથમ અપીલ પરતેના નિર્ણય સામે બીજી અપીલ અને તે અન્વયે માહિતી આયોગના ચુકાદા સામે વડી અદાલતમાં રીટ પીટીશન થઈ હોય તો તેવી એપેલેટ ઓથોરીટીની પ્રથમ અપીલની ફાઈલ	૫-૧
(૯)	PIO એ નિભાવવાના રજીસ્ટર	૧
(૧૦)	એપેલેટ ઓથોરીટીએ નિભાવવાના રજીસ્ટર	૧
(૧૧)	ત્રિ માસિક માહિતીની ફાઈલો	૧
(૧૨)	અન્યુઅલ રીટનની ફાઈલો	૧
(૧૩)	જે તે વર્ષ માટેના પ્રો એક્ટિવ ડીસ્કલોઝરની ફાઈલ	૫-૧
(૧૪)	આરટીઆઈ કાયદા નીચે મદદનીશ જાહેર માહિતી અધિકારી / જાહેર માહિતી અધિકારી / એપેલેટ ઓથોરીટી તરીકે નિમણું કરવા અંગેની ફાઈલ.	૧